

SCO સભ્યોએ તેમનું કવરેજ જાળવી રાખવા માટે Medicareમાં નોંધણી કરાવવી આવશ્યક છે

▪ SCO સભ્યોએ Medicareમાં નોંધણી કરાવવી આવશ્યક છે.

- જે સભ્યો મફતમાં Medicare માટે **પાત્ર નથી** તેઓ તેમનું MassHealth કવરેજ જાળવી રાખશે પરંતુ 31 ડિસેમ્બર, 2025 પછી SCOમાં રહી શકશે નહીં.
- જે સભ્યો **મફતમાં Medicare માટે પાત્ર છે** તેઓ જો Medicareમાં નોંધણી નહીં કરાવે તો તેઓ તેમના MassHealth અને SCO પ્લાન કવરેજ બંને ગુમાવશે.

▪ SCO સભ્યો કે જેમની પાસે **પહેલેથી જ Medicare અને MassHealth બંને છે** તેઓ આ ફેરફારથી પ્રભાવિત થશે નહીં.

તમારા MassHealth કવરેજને જાળવી રાખવા માટે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (SSA) સાથે તમારી Medicare એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો.

એપ્લિકેશન કેવી રીતે કરવી તે અહીં છે:

1. એપ્લિકેશન એપોઇન્ટમેન્ટની વિનંતી કરવા માટે તમારે તમારા સ્થાનિક સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન ફીલ્ડ ઓફિસને સીધો **કોલ કરવાનો અથવા રૂબરૂમાં મુલાકાત** લેવાની રહેશે. **તમે તમારી એપોઇન્ટમેન્ટ ઓનલાઇન શેડ્યૂલ કરી શકતા નથી.** તમારા સ્થાનિક સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન ઓફિસ સાથે Medicare એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવામાં મદદ માટે તમે 1-855-670-5934 (TTY 711) પર પણ અમારો સંપર્ક કરી શકો છો.
2. **Medicare એપોઇન્ટમેન્ટ માટે તૈયારી કરો**
SSA સાથે એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરતી વખતે આ માહિતી પ્રદાન કરો:
 - સોશિયલ સિક્યુરિટી નંબર
 - જન્મ તારીખ
 - પૂરું નામ
 - ટપાલનું સરનામું
 - જન્મનો દેશ
 - વૈવાહિક સ્થિતિ (એકલા, પરિણીત, છૂટાછેડા લીધેલા, વિધવા)
 - તમારી નોંધાયેલ નાગરિકતા અથવા કાયમી નિવાસી સ્થિતિ
 - એપોઇન્ટમેન્ટ માટે તમારો સંપર્ક કરવા માટે SSA એ જે ફોન નંબરનો ઉપયોગ કરવો જોઈએ તે ફોન નંબર.
 - SSA દ્વારા માંગવામાં આવતા અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ.
3. **મારી Medicare એપ્લિકેશનની એપોઇન્ટમેન્ટમાં મારે શું લાવવાની જરૂર છે?**
“સોશિયલ સિક્યુરિટી ઓફિસ માટે માહિતી” નામના આ ડોક્યુમેન્ટની પાછળનો ભાગ સોશિયલ સિક્યુરિટી ઓફિસને બતાવો. આ ડોક્યુમેન્ટ સમજાવે છે કે તમે લાયકાત ધરાવતા Medicare લાભાર્થી છો જેને Medicareમાં નોંધણી કરાવવી જરૂરી છે. આ SSA ઓફિસને તમારી એપ્લિકેશનની યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં મદદ કરશે. જો તમે ફોન પર Medicare એપોઇન્ટમેન્ટમાં હાજરી આપી રહ્યા છો, તો કૃપા કરીને તેમને આ ડોક્યુમેન્ટમાં શું છે તે સમજાવો.

4. જો તમને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન ઓફિસ સુધી પહોંચવા માટે પરિવહનની જરૂર હોય, તો કયા વિકલ્પો ઉપલબ્ધ છે તે જાણવા માટે કૃપા કરીને તમારા કેર મેનેજરનો સંપર્ક કરો.

સોશિયલ સિક્યુરિટી ઓફિસ માટે માહિતી

જેમને લાગુ પડતું હોય તેમના માટે:

MassHealth (Massachusetts Medicaid Program) માટે, મારે Medicare માટે લાયકાત ધરાવતા Medicare લાભાર્થી (QMB) તરીકે એપ્લિકેશન કરવી જરૂરી છે.

નીચે QMBs માટે ભાગ A નોંધણીઓ સંબંધિત સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના પ્રોગ્રામ ઓપરેશન્સ મેન્યુઅલ (POMS)માંથી એક સંદર્ભ આપેલો છે:

- HI 00801.140 લાયકાત ધરાવતા Medicare લાભાર્થીઓ (QMBs) માટે પ્રીમિયમ-ભાગ A નોંધણીઓ - ભાગ A બાય-ઇન રાજ્યો અને ગ્રૂપ ચુકવણીકર્તા રાજ્યો

A. બેકગ્રાઉન્ડ ભાગ A અને ભાગ B નોંધણીઓ

લાયકાત ધરાવતું Medicare લાભાર્થી (QMB) ગ્રૂપ એ Medicaid પાત્રતા ગ્રૂપ છે જેના દ્વારા રાજ્યો ઓછી આવક ધરાવતા Medicare લાભાર્થીઓ માટે Medicare ભાગ A (હોસ્પિટલ વીમો) અને ભાગ B પ્રીમિયમ (મેડિકલ વીમો) અને ખર્ચ-શેરિંગને આવરી લે છે. QMB ગ્રૂપ અને અન્ય સંબંધિત Medicare સેવિંગ્સ પ્રોગ્રામ્સ (MSPs) વિશે વધુ માહિતી માટે, [HI 00801.139](#) અને [HI 00815.024](#) જુઓ.

Medicare સ્ટેટ બાય-ઇન કરારો નોંધણી સમયગાળાના નિયંત્રણો અને નોંધણી પ્રીમિયમ મોડું ચૂકવવાથી થતા દંડને દૂર કરીને રાજ્યો દ્વારા તેમના Medicaid પ્રાપ્તકર્તાઓ માટે Medicare પ્રીમિયમની ચુકવણીને સરળ બનાવે છે. [HI 00815.001](#) માં દર્શાવ્યા મુજબ, આ કરારો રાજ્યોને Medicare ભાગ Bમાં લાયક વ્યક્તિઓની આપમેળે નોંધણી કરવાની મંજૂરી આપે છે. બધા સ્ટેટ બાય-ઇન કરારોમાં QMBs માટે ભાગ B શામેલ છે.

Information for the Social Security Office

To Whom It May Concern:

MassHealth (Massachusetts Medicaid Program), requires that I apply for Medicare as a Qualified Medicare Beneficiary (QMB).

Below is a citation from the Social Security Administration's Program Operations Manual (POMS) regarding Part A Enrollments for QMBs:

- HI 00801.140 Premium-Part A Enrollments for Qualified Medicare Beneficiaries (QMBs) – Part A Buy-In States and Group Payer States

A. Background Part A and Part B Enrollments

The Qualified Medicare Beneficiary (QMB) group is a Medicaid eligibility group through which states cover [sic] Medicare Part A (Hospital Insurance) and Part B premiums (Medical Insurance) and cost-sharing for low-income Medicare beneficiaries. For more information on the QMB group and other related Medicare Savings Programs (MSPs), see [HI 00801.139](#) and [HI 00815.024](#).

Medicare State Buy-in agreements facilitate the payment of Medicare premiums by States on behalf of their Medicaid recipients by removing enrollment period restrictions and any late premium enrollment penalties. As outlined in [HI 00815.001](#), these agreements permit States to automatically enroll eligible individuals into Medicare Part B. All State Buy-in agreements include Part B for QMBs.